

# ખાસ વસ્તીઓની સેવામાં: વિદેશી વસવાટીઓ

સહાયકો માટે ઝડપી હકીકતો

## આ હકીકત પત્રિકા લાગુ પડે છે જો તમે:

- સંઘીય-સગવડમય માર્કેટ પ્લેસ (FFM) કે રાજ્યની ભાગીદારીના માર્કેટ પ્લેસવાળા (SPM) રાજ્યમાં એક નેવિગેટર (પ્રવાસ માર્ગદર્શક), નેવિગેટર સિવાયના સહાયતા કર્મચારી (“રૂબરૂમાં સહાયક”), અથવા પ્રમાણિત એપ્લિકેશન કાઉન્સેલર (CAC) (સામુહિક રીતે, એક સહાયક) હો; અને/અથવા
- વિદેશી વસવાટીઓને તેઓની આરોગ્ય સંભાળ અને વીમા કવચના વિકલ્પો શોધવામાં સહાયતા કરતા હો.

## વિદેશી વસવાટીઓ હોય તેવા ગ્રાહકો: સંક્ષિપ્ત સમીક્ષા

ઘણાં વિદેશી વસવાટીઓ (ઇમિગ્રાન્ટ્સ) આરોગ્ય વીમો માર્કેટ પ્લેસ (માર્કેટ પ્લેસ) કે મેડિકએઇડ અથવા બાળકોના આરોગ્ય વીમા કાર્યક્રમ (CHIP) મારફતે આરોગ્ય વીમા કવચ માટે પાત્ર હોય છે. માર્કેટ પ્લેસ મારફતે મેડિકએઇડ કે CHIP માટે લાયક ઠરવા, અથવા લાયક આરોગ્ય યોજનામાં (QHP) પ્રવેશ મેળવવા ગ્રાહકે યુએસ નાગરિક કે યુએસ રાષ્ટ્રીય હોવું પડતું નથી. નવું આરોગ્ય વીમા કવચ મેળવનાર વિદેશી વસવાટીઓને મદદરૂપ થતા સહાયકોએ આ ગ્રાહકોની જુદી જુદી આરોગ્ય સંભાળ અને વીમા કવચના વિકલ્પોની પાત્રતાને અસર કરતા સંઘીય અને રાજ્યના નિયમોથી અચૂક માહિતગાર રહેવું. વિદેશી વસવાટીઓને પોતાના આરોગ્ય સંભાળ વીમા કવચના વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થવા સહાયકોએ અરજી અને પ્રવેશ પ્રક્રિયા પણ સમજવી જોઈએ. વધુમાં, સહાયકોએ સહાયતા પૂરી પાડવી જોઈએ જે સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે યોગ્ય હોય.

પોતાની ઇમિગ્રેશન સ્થિતિ અને અન્ય પાત્રતા માપદંડ આધારિત, વિદેશી વસવાટીઓ માર્કેટ પ્લેસ, મેડિક એઇડ કે CHIP મારફતે આરોગ્ય વીમા કવચ માટે પાત્ર હોઈ શકે. જો ગ્રાહકો રાજ્યમાં તમામ મેડિકએઇડ પાત્રતા માપદંડ સંતોષે (જેમ કે આવક અને રાજ્યમાં વસવાટ), તો મેડિકએઇડ ઇમિગ્રેશન સ્થિતિને ધ્યાનમાં ન લઈને તબીબી કટોકટીની સ્થિતિની સારવાર કરવા ચૂકવણી પૂરી પાડે છે. વધુમાં, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHCs) અને સ્થળાંતરકર્તા આરોગ્ય કેન્દ્રો (MHCs) ચૂકવણી કરવાની ક્ષમતા કે ઇમિગ્રેશન સ્થિતિને ધ્યાનમાં ન લઈને વ્યાપક પ્રાથમિક સંભાળ પૂરી પાડે છે. જોકે, MHCs, માત્ર સ્થળાંતરકર્તા અને લાયક ખેતમજૂરો અને તેઓના કુટુંબીજનોને સેવા આપે છે.

સહાયકો વિદેશી વસવાટી ગ્રાહકોને સંબંધિત નીચેના વિષયોથી માહિતગાર હોવા જોઈએ:

1. માર્કેટ પ્લેસ પાત્રતા: વિદેશી વસવાટીઓ જેઓ કાયદેસર રીતે હાજર હોય અને અન્ય મૂળભૂત માર્કેટ પ્લેસ પાત્રતા સંતોષતા હોય, તેઓ માર્કેટ પ્લેસ મારફતે વીમા કવચ મેળવવાને પાત્ર હોઈ શકે. નીચે પ્રદર્શન 1- માર્કેટ પ્લેસ વીમા કવચ મેળવવાને પાત્ર ઇમિગ્રેશન સ્થિતિઓ કાયદેસર રીતે હાજર ઇમિગ્રેશન સ્થિતિઓનો સારાંશ જુઓ. આ અરજીકર્તાઓ કુટુંબની આવક અને કૌટુંબિક કદ સહિતના, કેટલાક વધારાના માપદંડના આધારે, માર્કેટ પ્લેસ મારફતે નાણાકીય સહાયતા માટે પણ પાત્ર હોઈ શકે.

પ્રદર્શન 1 – માર્કેટ પ્લેસ વીમા કવચ મેળવવાને પાત્ર ઇમિગ્રેશન સ્થિતિઓ

કાયદેસર રીતે હાજર ઇમિગ્રેશન સ્થિતિઓ

માત્ર માર્કેટ પ્લેસ પાત્ર સ્થિતિ

- માન્ય ઇમિગ્રાન્ટ સિવાયની સ્થિતિવાળી વ્યક્તિ (જેમાં કામદાર વિઝાઓ (જેમ કે HI, H-2A, H-2B), વિદ્યાર્થી વિઝાઓ, U-વિઝા, T-વિઝા અને અન્ય વિઝાઓ તથા માઇક્રોનેશિયા, માર્શલ આઇલેન્ડ્સ અને પલાઉના નાગરિકોનો સમાવેશ થાય છે)
- એલિયન્સ (અજાણી વ્યક્તિઓ) જેઓની વિઝા અરજીઓ મંજૂર થઇ હોય અને જેઓની અરજી સ્થિતિ અનુકૂળ કરવા માટે બાકી હોય
- રોજગાર અધિકૃતિની મંજૂરી ધરાવનાર વ્યક્તિઓ
- હંગામી સંરક્ષિત સ્થિતિ (TPS)
- યુએસમાં પેરોલ પર છૂટેલ વ્યક્તિ
- સ્થગિત કાર્યવાહી સ્થિતિ (અપવાદ: સ્થગિત કાર્યવાહીને આધિન બાળપણમાં પર્હોચનારાઓને (DACA) કાયદેસર રીતે હાજર ગણવામાં આવતા નથી)
- સ્થગિત લાગુ કરેલ નિર્ગમન (DED)
- ખાસ ઇમિગ્રાન્ટ કિશોર સ્થિતિ મેળવવાનું બાકી હોય તેવું બાળક
- શારીરિક પીડા વિરોધી પ્રણાલી હેઠળ મંજૂર કરેલી રાહત (CAT)
- કાયદેસર હંગામી રહેવાસી
- કૌટુંબિક એકતા લાભાર્થીઓ
- નીચે યાદીબદ્ધ મેડિક્ષેઇડ પાત્ર તમામ સ્થિતિઓ

મેડિક્ષેઇડ પાત્ર સ્થિતિ  
(જો 5-વર્ષની મનાઇ સંતોષાય)\*

- કાયદેસર કાયમી રહેવાસી (LPR/ગ્રીન કાર્ડ ધારક)
- શરત હેઠળ પ્રવેશનાર
- 1 વર્ષ કે વધારે સમય માટે યુએસમાં પેરોલ પર છૂટનાર વ્યક્તિ
- માર સહન કરનાર પત્ની કે પતિ, બાળક અથવા માતા-પિતા જેઓની અરજી DHS સાથે બાકી રહી હોય કે મંજૂર થઇ હોય

મેડિક્ષેઇડ પાત્ર સ્થિતિ  
(5-વર્ષની મનાઇ લાગુ પડતી નથી)\*\*

- ગેરકાયદેસર મનુષ્ય હેરફેરથી બચનારાઓ અને તેઓની પત્ની કે તેઓના પતિ, બાળકો, ભાઇઓ-બહેનો કે માતા-પિતા
- કાયદેસર કાયમી રહેવાસીઓ જેઓને 5 વર્ષની મનાઇ સ્થિતિમાંથી છૂટ મળી હોય
- લશ્કરમાંથી નિવૃત્ત કે સક્રિય ફરજ પર અને તેઓની પત્ની કે પતિ અથવા અપરણિત આશ્રિતો જેઓ પણ “લાયક બિન-નાગરિક” સ્થિતિ ધરાવતા હોય
- શરણાર્થી
- આશ્રય મેળવનાર
- ક્યુબા/હેઇતીના નાગરિક તરીકે પ્રવેશનાર
- દેશનિકાલ પાછું ખેંચવું અથવા કાઢી મૂકવાનું પાછું ખેંચવાની મંજૂરી મેળવનાર
- સંઘીય-ઓળખ ધરાવનાર ભારતીય જાતિની વ્યક્તિ કે કેનેડામાં જન્મનાર અમેરિકી ભારતીયના સભ્ય
- ચોક્કસ અમેરિકી એશિયાઇ વિદેશી વસવાટીઓ

કાયદેસર રીતે હાજર ઇમિગ્રેશન સ્થિતિઓ માટે, વેબસાઇટ જુઓ: [www.healthcare.gov/immigrants/immigration-status/](http://www.healthcare.gov/immigrants/immigration-status/)\*\*\*

- \* એવી કાયદેસર રીતે હાજર ઇમિગ્રેશન સ્થિતિઓ દર્શાવે છે જેને મેડિકએઇડ પાત્રતાના હેતુસર લાયક બિન-નાગરિક સ્થિતિઓ ગણવામાં આવે
- \*\* એવી કાયદેસર રીતે હાજર ઇમિગ્રેશન સ્થિતિઓ દર્શાવે છે જેને મેડિકએઇડ પાત્રા હેતુસર લાયક બિન-નાગરિક સ્થિતિઓ ગણવામાં આવે અને જેઓ 5-વર્ષની મનાઇને આધિન ના હોય
- \*\*\* આ ઉત્પાદની વિદેશી આવૃત્તિ આ સમયે ઉપલબ્ધ નથી.

આ નક્શો ઇમિગ્રેશન સ્થિતિને સંબંધિત જટિલ સંઘીય સ્થિતિઓના સારાંશને પ્રતિબિંબિત કરે છે. સારાંશ તરીકે, તેમાં તમામ સંબંધિત વિગત સમાવેલી હોતી નથી. આ પ્રકાશન કાયદેસર દસ્તાવેજ નથી અને કોઇ અધિકારોની મંજૂરી આપતું નથી કે ફરજો લાગુ કરતું નથી. કાં તો કોઇપણ લેખિત કાયદો અથવા તો નિયમોની બદલીમાં તે અમલી બને તેવો હેતુ રાખવામાં આવતો નથી.

**2. મેડિકએઇડ કે CHIP પાત્રતા:** સામાન્ય રીતે, નાગરિકો ન હોય તેવી વ્યક્તિઓ અને “લાયકાત ધરાવનાર નાગરિક સિવાયની” ઇમિગ્રેશન સ્થિતિ ધરાવનાર વ્યક્તિઓ મેડિકએઇડ કે CHIP માં પ્રવેશ મેળવવાને પાત્ર હોય છે, જો તેઓ રાજ્યમાં અન્યથા મેડિકએઇડ કે CHIP માટે પાત્ર ઠરે (એટલે કે આવક અને રાજ્ય વસવાટનો માપદંડ સંતોષતા હોય). “લાયકાત ધરાવનાર નાગરિક સિવાયની” ઇમિગ્રેશન સ્થિતિઓને ઉપર પ્રદર્શન 1 – માર્કેટ પ્લેસ વીમા કવચ મેળવવાને પાત્ર ઇમિગ્રેશન સ્થિતિઓમાં એક તારાના ચિહ્ન વડે ઓળખવામાં આવે છે. વધુમાં, સંઘીય કાયદામાં જરૂરી છે કે લાયકાત ન ધરાવનાર ઘણાં નાગરિકો મેડિકએઇડ કે CHIP માટે પાત્ર બને તે પહેલાં પાંચ વર્ષનો (આને “પાંચ-વર્ષની મનાઇ” પણ કહેવામાં આવે છે). આ પાંચ-વર્ષનો રાહ જોવાનો સમયગાળો ત્યારે શરૂ થાય છે જ્યારે ગ્રાહકોને પોતાની લાયક બનાવતી ઇમિગ્રેશન સ્થિતિ મળે, પણ તેઓ પહેલી વાર યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ ત્યારે નહીં. જોકે, ચોક્કસ ઇમિગ્રેશન સ્થિતિઓ ધરાવતા ગ્રાહકોને પાંચ-વર્ષના રાહ જોવાના સમયગાળામાંથી મુક્તિ મળે છે. “લાયકાત ધરાવનાર નાગરિક સિવાયની” ઇમિગ્રેશન સ્થિતિઓ જેમાં 5-વર્ષ રાહ જોવાના સમયગાળામાંથી મુક્તિ મળતી હોય (જેમ કે શરણાર્થીઓ, આશ્રિતો, અને ક્યુબા-હેઇતીમાંથી પ્રવેશનારાઓને) ઉપર દર્શન 1 – માર્કેટ પ્લેસ વીમા કવચ મેળવવાને પાત્ર ઇમિગ્રેશન સ્થિતિઓમાં બે તારાના ચિહ્નથી ઓળખવામાં આવે છે.

**મહત્વની નોંધ:** કેટલાક રાજ્યોએ બાળકો અને/અથવા સગર્ભા સ્ત્રીઓને કાયદેસર રજૂ કરવા મેડિકએઇડ અને CHIP માટે વીમા કવચ વિસ્તાર્યું છે, પછી ભલે તેઓને “લાયકાત ધરાવનાર નાગરિકો સિવાયના” ગણવામાં આવે અથવા તેઓ પાંચ-વર્ષનો રાહ જોવાનો સમયગાળો સંતોષતા હોય, જો રાજ્યમાં અન્યથા મેડિકએઇડ કે CHIP માટે પાત્ર બને.

- આ કડી (લિંક) બતાવે છે કે કયા રાજ્યો બાળકો અને/અથવા સગર્ભા સ્ત્રીઓને કાયદેસર રજૂ થવા દેવાને આવરી લે છે: <http://www.medicaid.gov/medicaid-chip-program-information/by-topics/outreach-and-enrollment/lawfully-residing.html>\*\*\*
- આ લિંકમાં દરેક રાજ્યના મેડિકએઇડ પાત્રતા માપદંડ પર માહિતી આપેલી છે: <http://www.medicaid.gov/medicaid-chip-program-information/by-state/by-state.html>\*\*\*.

મેડિકએઇડ પાત્રતા વિશે વધુ ચોક્કસ માહિતી માટે, આ વેબસાઇટ પરના ડ્રોપ ડાઉન મેનુનો ઉપયોગ કરીને તમારા રાજ્યની મેડિકએઇડ ઓફિસનો સંપર્ક કરો: <https://www.healthcare.gov/medicaid-chip/eligibility/>\*\*\*.

જો નાગરિકો સિવાયની વ્યક્તિઓ મેડિકએઇડ માટે પાત્ર ન હોય, કાં તો તેઓ કાયદેસર રીતે હાજર હોવા છતાં પણ “લાયકાત ધરાવનાર નાગરિક સિવાયની” ઇમિગ્રેશન સ્થિતિ ન ધરાવતા હોવાને લીધે અથવા તો “લાયકાત ધરાવનાર નાગરિક સિવાયના” હોય પણ પાંચ-વર્ષનો રાહ જોવાનો સમયગાળો સંતોષતા ન હોય, તો આ નાગરિક સિવાયના ગ્રાહકો માર્કેટ પ્લેસ મારફતે નાણાકીય સહાયતા માટે પાત્ર હોઇ શકે જો તેઓ અન્યથા માર્કેટ પ્લેસ પાત્રતાની જરૂરિયાતો સંતોષતા હોય. વધુમાં, મેડિકએઇડ કટોકટીભરી તબીબી સ્થિતિઓની સારવાર માટે કટોકટીની

સેવાઓ માટે ચૂકવણી પૂરી પાડે છે, જો ગ્રાહકો રાજ્યમાં બીજા બધા મેડિકએઇડ પાત્રતા નિયમો સંતોષે પણ પાત્ર ઇમિગ્રેશન સ્થિતિ ન ધરાવતા હોય.

3. માર્કેટ પ્લેસ વીમા કવચ માટે પાત્રતા ન ધરાવતા દસ્તાવેજીકરણ ન કર્યો હોય તેવા વિદેશી વસવાટીઓ: દસ્તાવેજીકરણ ન કર્યું હોય તેવા વિદેશી વસવાટીઓ પૂરો ખર્ચો કરીને પણ, માર્કેટ પ્લેસ મારફતે વીમા કવચ મેળવવાને પાત્ર હોતા નથી, જોકે તેઓ માર્કેટ પ્લેસ બહાર વીમા કવચ ખરીદવાને પાત્ર બની શકે. મેડિકએઇડ કટોકટીભરી તબીબી સ્થિતિઓની સારવાર માટે કટોકટીની સેવાઓ માટે ચૂકવણી પૂરી પાડે છે, જો વ્યક્તિ રાજ્યમાં બીજા બધા મેડિકએઇડ પાત્રતા નિયમો સંતોષે (દા.ત. આવક અને રાજ્યમાં વસવાટ) પણ પાત્ર ઇમિગ્રેશન સ્થિતિ ન ધરાવે. વધુમાં, ચોક્કસ રાજ્યોમાં, કેટલીક સગર્ભા સ્ત્રીઓ ઇમિગ્રેશન સ્થિતિને ધ્યાનમાં લીધા વગર સગર્ભાવસ્થા દરમિયાન આરોગ્ય વીમા કવચ મેળવવાને સક્ષમ હોઈ શકે.
4. બાળપણમાં પ્રવેશનારાઓ માટે સ્થગિત કાર્યવાહીની મંજૂરી ધરાવનાર વ્યક્તિઓ (DACA) માર્કેટ પ્લેસ વીમા કવચ મેળવવાને પાત્ર હોતા નથી: તા. 15 જૂન, 2012 નાં રોજ આપેલ DHS માર્ગદર્શન હેઠળ સ્થગિત કાર્યવાહીની મંજૂરી મેળવનાર વ્યક્તિઓ માર્કેટ પ્લેસ મારફતે વીમા કવચ ખરીદવાને પાત્ર હોતી નથી.<sup>1</sup>
5. કાયદેસર રીતે હાજર વિદેશી વસવાટીઓ આર્થિક સહાય મેળવવાને પાત્ર હોઈ શકે જો તેઓની આવક સંઘીય ગરીબી રેખાની (FPL) નીચે હોય: મોટા ભાગના ગ્રાહકોની વાર્ષિક કરપાત્ર કુટુંબની આવક નાણાકીય સહાયતા મેળવવા પાત્ર બનવાના હેતુસર FPL ની 100% અને 400% વચ્ચે હોય છે. જોકે, ઇમિગ્રેશન સ્થિતિને લીધે મેડિકએઇડ માટે પાત્ર ન હોય તેવા કાયદેસર રીતે હાજર વિદેશી વસવાટીઓ નાણાકીય સહાયતા મેળવવાને પાત્ર હોઈ શકે પછી ભલે તેઓની આવક FPL નાં 100% થી નીચે હોય.

## ઇમિગ્રેશન સ્થિતિ ચકાસવી અને તેનું પ્રમાણ પૂરું પાડવું

માર્કેટ પ્લેસ અરજી આરોગ્ય વીમા કવચના વિકલ્પો માટે અરજદારોને નાગરિકતા અને ઇમિગ્રેશન સ્થિતિ વિશે પૂછે છે. નાગરિકતા અને ઇમિગ્રેશન માહિતી માત્ર એવા કુટુંબીજનો માટે એકઠી કરવામાં આવે છે અને ચકાસવામાં આવે છે જેઓ વીમા કવચ માટે અરજી કરી રહ્યાં હોય. માત્ર ગ્રાહકોની પાત્રતા નિર્ધારિત કરવા આ માહિતીનો ઉપયોગ કરવામાં આવશે અને ઇમિગ્રેશન લાગુ કરવાના હેતુસર ઉપયોગ કરવામાં આવશે નહીં. વધુ માહિતી માટે, કૃપા કરી યુએસ ઇમિગ્રેશન કસ્ટમ્સ અને એન્ફોર્સમેન્ટની (ICE) નીચેની નોંધ (મેમોરેન્ડમ) (અંગ્રેજી અને સ્પેનિશમાં) જુઓ:

<https://www.ice.gov/doclib/ero-outreach/pdf/ice-aca-memo.pdf><sup>\*\*\*</sup>.

## મિશ્રિત ઇમિગ્રેશન સ્થિતિવાળા કુટુંબો

સહાયકોએ માહિતગાર રહેવું જોઈએ કે કેટલાક ગ્રાહકો મિશ્રિત ઇમિગ્રેશન સ્થિતિ કુટુંબમાં રહેતા હોય છે જે કુટુંબ જુદી જુદી નાગરિકતા કે ઇમિગ્રેશન સ્થિતિઓ ધરાવતા લોકોનું બનેલું હોય છે. આવી સ્થિતિમાં, દરેક કુટુંબીજન પોતાની નાગરિકતા કે ઇમિગ્રેશન સ્થિતિ આધારિત જુદા જુદા આરોગ્ય વીમા કવચના વિકલ્પો માટે પાત્ર હોઈ શકે.

<sup>1</sup> આ માર્ગદર્શિકા પ્રકાશિત થવાના સમયે કે વેબ પર જાહેર થવાના સમયે હાલની તારીખની માહિતી ધરાવતી હતી. પાત્રતા પોલિસીઓ અવારનવાર બદલાઈ શકે.

### કુટુંબીજનો વતી વીમા કવચ માટે અરજી કરવી

સહાયકો એ પણ જાણતા હોવા જોઈએ કે ગ્રાહકો પોતાના પાત્રતા ધરાવતા આશ્રિતો વતી વીમા કવચ માટે અરજી કરી શકે છે પણ ભલે તેઓ પોતાની રીતે વીમા કવચ માટે પાત્ર ના હોય.

### પોતાના માટે વ્યાપક વીમા કવચ શોધતા ગ્રાહકો

પોતાના માટે વ્યાપક વીમા કવચ શોધતા ગ્રાહકો પાત્ર ઇમિગ્રેશન સ્થિતિ અથવા નાગરિક કે રાષ્ટ્રીય હોવાનું પ્રમાણ આપવા અચૂક સક્ષમ હોવા જોઈએ, જેને સોશિયલ સિક્યુરીટી એડમિનિસ્ટ્રેશન (SSA) અને/અથવા DHS મારફતે માર્કેટ પ્લેસ દ્વારા ચકાસવામાં આવશે. પાત્ર ઇમિગ્રેશન સ્થિતિ હોવાનું પ્રમાણ આપતા ગ્રાહકોએ પોતાના ઇમિગ્રેશન દસ્તાવેજનો પ્રકાર અને પોતાની પાસે ઉપલબ્ધ દસ્તાવેજ સંખ્યાઓ પૂરી પાડવી જોઈએ, માર્કેટ પ્લેસની અરજીમાં માગણી કર્યા મુજબ (નીચે પ્રદર્શન 2- ઇમિગ્રેશન સ્થિતિ ચકાસવા દસ્તાવેજના પ્રકારની પસંદગી દર્શાવતો સ્ક્રીન જુઓ). અરજી સાથે આ માહિતી પૂરી પાડવાથી ચકાસણી અને પાત્રતા નિર્ધારણ પ્રક્રિયા વધારે ઝડપી બને છે અને વ્યક્તિઓને “અસંગત” ડેટા મળતા આવવા (નીચે વર્ણવ્યા પ્રમાણે) જેવી બીનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. યુએસ નાગરિકોનું અથવા પાત્ર ઇમિગ્રેશન સ્થિતિનું પ્રમાણ ન પૂરું પાડી શકનાર ગ્રાહકો માર્કેટ પ્લેસ મારફતે આરોગ્ય વીમા કવચ મેળવી શકતા નથી, પણ તેઓ હજુ પણ માર્કેટ પ્લેસ અરજી ભરી શકે જો તેઓ કટોકટીભરી તબીબી સ્થિતિઓની સારવાર કે ચોક્કસ રાજ્યોમાં સગર્ભા સ્ત્રીઓ માટે મેડિકેઇડ મારફતે સેવાઓ મેળવવાને પાત્ર હોય જો તેઓ પોતાના રાજ્યમાં મેડિકેઇડ કે CHIP માટે અન્ય પાત્રતા માપદંડ સંતોષતા હોય.

ગ્રાહકો પોતાની પાત્રતા સ્થિતિઓને ધ્યાનમાં લીધા વગર, પોતાના કુટુંબીજનો વતી માર્કેટ પ્લેસ, મેડિકેઇડ કે CHIP મારફતે વીમા કવચ માટે અરજી કરી શકે.

ઉદાહરણ તરીકે, યુએસ નાગરિકોના દસ્તાવેજીકરણ નહિ કરાવનાર માતા-પિતાઓ અરજી દાખલ કરનાર તરીકે પોતાના બાળકો વતી કવચ માટે અરજી કરી શકે છે. આ કિસ્સામાં, અરજી દાખલ કરવાથી પ્રમાણ મળે છે કે વીમા કવચ માટે અરજી કરનાર કુટુંબીજન યુએસ નાગરિક છે અથવા પાત્ર ઇમિગ્રેશન સ્થિતિ ધરાવે છે. અન્ય કુટુંબીજનો માટે અરજી કરો અને પોતાના માટે વીમા કવચ ન શોધો ત્યારે, અરજી દાખલ કરનારાઓએ પોતાની નાગરિકતા કે ઇમિગ્રેશન સ્થિતિ વિશે માહિતી પૂરી પાડવાની જરૂર પડતી નથી, તેને બદલે તેઓએ વીમા કવચ શોધતા કુટુંબીજનો માટે નાગરિકતા અને ઇમિગ્રેશન માહિતી પૂરી પાડવાની જરૂર પડે છે. તેઓની અરજીમાંની માહિતી ઇમિગ્રેશન લાગુ કરવાના હેતુસર દાખલ કરવા ઉપયોગમાં લેવાશે નહીં. જો આ અરજી દાખલ કરનારાઓને ચકાસણી પ્રક્રિયામાં મદદની જરૂર પડે, તો તેઓ માર્કેટ પ્લેસ કોલ સેન્ટરને ફોન કરી શકે છે.

## પ્રદર્શન 2 – ઇમિગ્રેશન સ્થિતિ ચકાસવા દસ્તાવેજના પ્રકારની પસંદગી દર્શાવતો સ્ક્રીન<sup>2</sup>

Application ID: 97104741

**GET STARTED**

**FAMILY & HOUSEHOLD**

1

2 More about this household

3 Summary

**INCOME**

**ADDITIONAL INFORMATION**

**REVIEW & SIGN**

**Document type (Select one)**  
Learn more about document types

Permanent Resident Card ("Green Card", I-551)

The I-551 Permanent Resident Card, or "Green Card", is issued to immigrants who enter the U.S. to reside permanently. Enter the Alien number (starts with an "A," followed by 7-9 digits) and card number, as listed on the card.

Alien number *optional*  Card number *optional*

AXXXXXXXXX **Enter your card number.** XXXXXXXXXXXXXX

**!** If you only have an alien number, select "Other documents or status types." You'll be asked "Does Joseph Carlson also have any of these documents or status types?" Select "Other." Then enter your document description and your alien number.

Is  the same name that appears on his document?

Yes  No

### ઓળખ અને પાત્રતા માહિતી ચકાસવી

જ્યારે ગ્રાહકો વીમા કવચ માટે અરજી કરે, ત્યારે માર્કેટ પ્લેસે પોતાની ઓળખ તેમજ તેઓ પાત્રતા ધરાવતા હોઈ શકે તેવું વીમા કવચ અને નાણાકીય સહાયતા નિર્ધારિત કરતી તેઓને લગતી અન્ય માહિતી ચકાસવાની જરૂર પડે છે. ઓળખ ચકાસણીને “ઓળખ (આઈડી) પુરાવો” પણ કહેવામાં આવે છે અને દાવો કરનાર દરેક અરજીકર્તાને છળકપટથી માર્કેટ પ્લેસનું ખાતું ખોલતા રોકવા અને બીજા ગ્રાહકને જાણ થવા દીધા વગર ગ્રાહકના નામમાં આરોગ્ય વીમા કવચ માટે અરજી કરી હોવાની ખાતરી કરીને તે ગ્રાહકોની અંગત માહિતીનું સંરક્ષણ કરે છે. આઈડી પુરાવો માર્કેટ પ્લેસ અરજીનો મહત્વનો ભાગ છે અને ન ઉકેલેલા આઈડી પુરાવા મુદ્દાઓ ગ્રાહકોને ઓનલાઇન અરજી કરાવતા રોકી શકે છે. આઈડી પુરાવો ભરવા, ગ્રાહકો પોતાના વિશે અંગત માહિતી દાખલ કરે છે, જેમ કે તેઓ ક્યાં રહેતા હતા અથવા તેઓનું બેંક ખાતું ક્યાં છે. (કૃપા કરી વધુ માહિતી માટે [પાત્રતા અને પ્રવેશ પડકારોને પહોંચી વળવાની ખાનગી માહિતી](#) નીચે જુઓ.)

### ડેટા મળતા આવવા સંબંધિત વિવાદો

ડેટા મળતા આવવા સંબંધિત વિવાદોને “અસંગતતા” પણ કહેવામાં આવે છે અને તેવું ત્યારે બને છે જ્યારે પોતાની માર્કેટ પ્લેસ અરજીમાં ગ્રાહકે દાખલ કરેલી માહિતી વિશ્વાસપાત્ર ડેટા સ્ત્રોતો પાસેથી માર્કેટ પ્લેસને મળેલી માહિતી સાથે મળતી ન આવે, જેમ કે SSA રેકોર્ડ્સ અથવા ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ (આઇઆરએસ) ડેટાબેઝીસ. ડેટા મળતા આવવાના વિવાદોના સૌથી સામાન્ય પ્રકારો આવક, નાગરિકતા અને ઇમિગ્રેશન માહિતીને સંબંધિત છે. [એકવાર ગ્રાહકો](#)

<sup>2</sup> કૃપા કરી નોંધી લેશો કે આ રજૂઆતમાં સમાવેલી માહિતી માત્ર દાખલા તરીકે આપેલી છે. નામો અને/અથવા ચોક્કસ રજૂકર્તાઓ/યોજનાઓ સાથે સ્ક્રીનશોટ્સ સમાવેલી સ્લાઇડો. આ સ્ક્રીનશોટ્સનો હેતુ ઉદાહરણો પૂરા પાડવાનો છે. રજૂ કરેલા નામોની ઉણપ પૂરી થાય છે અને રજૂકર્તા/યોજનાના દર્શાવેલા નામો કોઈ ક્રમ વિના પસંદ કરવામાં આવ્યા હતા. આ ઉદાહરણોમાં અંગત રીતે ઓળખી શકાતી માહિતી સમાવવામાં આવતી નથી અને ચોક્કસ રજૂકર્તાઓ/યોજનાઓની બાંહેધરી આપતી નથી.

અરજી કરે એટલે તેઓ શોધી કાઢી શકે છે જો માર્કેટ પ્લેસ પાસેથી તેઓને મળેલી નોટિસ તપાસીને તેઓને ડેટા મળતો આવવાનો મુદ્દો હોય. જો ગ્રાહકને ડેટા મળતો આવવાનો વિવાદ હોય, તો પાત્રતા નોટિસ કહેશે “માર્કેટ પ્લેસને વધારે માહિતી મોકલો.” ગ્રાહકોએ તાકીદની સૂચનામાં દર્શાવેલ સમયસીમાની અંદર આ વિનંતીનો જવાબ અચૂક આપવો અને ડેટા મળતા આવવાનો મુદ્દો ઉકેલવો નહિતર તેઓનો પ્રવેશ રદ થઈ જશે. માગેલા તમામ દસ્તાવેજોને વેબસાઇટ HealthCare.gov પર ગ્રાહકોના ખાતાઓમાં ઇલેક્ટ્રોનિક્સ અપલોડ કરવા એ અસંગતતાઓ ઉકેલવાની પસંદમય અને સૌથી કાર્યક્ષમ રીત છે. ગ્રાહકો પાસે પોતાના દસ્તાવેજોની નકલો સીધા માર્કેટ પ્લેસને ટપાલથી મોકલવાનો વિકલ્પ પણ રહે છે.

ગ્રાહકો પોતાની પાત્રતા નોટિસો કાળજીપૂર્વક વાંચે તે માટે સહાયકોએ તેઓને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી ખાતરી કરી શકાય કે તેઓ આ બધું રજૂ કરે છે:

- માગેલી તમામ માહિતી સામેલ છે;
- સાચા દસ્તાવેજો જો લાગુ પડે; અને
- પ્રવેશ સમૂહના સાચા સભ્ય માટેની માહિતી.

ઉદાહરણ તરીકે, માર્કેટ પ્લેસ અરજી દાખલ કરનાર સિવાયની કોઈ વ્યક્તિ માટે વધારાની માહિતી માગી શકે. પ્રવેશ સમૂહના સાચા સભ્ય માટે તમામ સાચી માહિતી અને દસ્તાવેજો રજૂ કરવાથી, જો લાગુ પડે, માર્કેટ પ્લેસને ડેટા મળતા આવવાનો મુદ્દો વહેલામાં વહેલી તકે ઉકેલવામાં મદદ મળશે.

ગ્રાહકો જેઓ વધારાની માહિતી રજૂ ન કરે અથવા સાચી વ્યક્તિ માટે સાચી માહિતી રજૂ ન કરે, તો તેઓને માર્કેટ પ્લેસ મારફતે પોતાનું વીમા કવચ ગુમાવવાનું જોખમ રહે છે. ઇમિગ્રેશન સ્થિતિ કે નાગરિકતા અસંગતતાઓ ધરાવતા ગ્રાહકોને બે ચેતવણી નોટિસો મળશે: એક 60 દિવસ પહેલાં અને બીજી એક નોટિસ વિવાદ ઉકેલવાની પોતાની છેલ્લી તારીખના 30 દિવસ પહેલાં. ચેતવણી નોટિસોની વિષય રેખામાં વંચાશે, “મહત્વની બાબત: નીચેની તારીખો સુધીમાં જવાબ આપો જેથી તમારું માર્કેટ પ્લેસ કવચ ચાલુ રહે અથવા તમારા માર્કેટ પ્લેસ વીમા કવચ માટે ચૂકવણી કરવામાં તમને મદદરૂપ થવાય.” દરેક નોટિસમાં તેઓને મોકલવાના સ્વીકાર્ય દસ્તાવેજો અને સૂચનાઓની યાદીનો સમાવેશ થાય છે, જેને ગ્રાહકોએ બારીકાઈથી વાંચવી જોઈએ જેથી ખાતરી કરી શકાય કે તેઓ સાચી માહિતી રજૂ કરી રહ્યા છે. ગ્રાહકોને પોતાના ડેટા મળતા આવવાનો વિવાદ ઉકેલવા તેઓની છેલ્લી તારીખના 14 દિવસ પહેલાં ફોન પણ કરવામાં આવશે.

## પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સહાયકો કેવી રીતે વિદેશી વસવાટીઓને મદદ કરી શકે છે

પોતાના માટે આરોગ્ય વીમા કવચ શોધતા વિદેશી વસવાટી ગ્રાહકો સાથે અથવા બીજી કોઈ વ્યક્તિ વતી વાત કરવામાં નીચેના શ્રેષ્ઠ વ્યવહારો સહાયકોને મદદ કરી શકે છે:

- વિદેશી વસવાટી ગ્રાહકોને ખાનગીપણું અને ગુપ્તતા વિશે, ખાસ કરીને તેઓની નાગરિકતા કે ઇમિગ્રેશન સ્થિતિઓ અને સામાજિક સુરક્ષા નંબરો (SSNs) વિશે પુનઃખાતરી કરાવતા સંદેશાઓથી શરૂઆત કરો. ગ્રાહકોને જાણ કરો કે સરકારી સંસ્થાઓ દ્વારા ઇમિગ્રેશન કાયદાઓ કે કાર્યનીતિઓ લાગુ કરવા તેઓએ પૂરી પાડેલી માહિતીનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
- ગ્રાહકો સાથે પાત્ર ઇમિગ્રેશન સ્થિતિઓ અને સ્વીકાર્ય ઇમિગ્રેશન દસ્તાવેજોને લગતી માહિતી વહેંચો જેથી તેઓના કુટુંબમાં આરોગ્ય વીમા કવચ માટે અરજી કરવા કોણ પાત્ર બની શકે તે નક્કી કરવામાં મદદ મળે.

- ગ્રાહકોની ભલામણ નફો નહિ રળતા ઇમિગ્રેશન એટોર્નીઓને કરવા તૈયાર રહો જેથી ચોક્કસ ના હોય તેવા ગ્રાહકોને મદદ મળી શકે કે જો તેઓ પાત્ર ઇમિગ્રેશન સ્થિતિઓ ધરાવે છે અથવા તેઓને ઇમિગ્રેશન દસ્તાવેજો મેળવવામાં મદદરૂપ થવું જો તેઓ પાસે તે તૈયારીમાં ઉપલબ્ધ ના હોય.
- આરોગ્ય વીમા કવચ માટે અરજી કરનાર ગ્રાહક કે ગ્રાહકો જો પોતાના માટે અથવા બીજી કોઈ વ્યક્તિ વતી આરોગ્ય વીમા કવચ શોધી રહ્યાં હોય, તો તેઓને સાચી રીતે ઓળખવાની ખાતરી કરો.
- સહાયકોએ ખાતરી કરીને મદદ કરવી જોઈએ કે ભાષા અથવા સાંસ્કૃતિક અવરોધો ગ્રાહકોની માર્કેટ પ્લેસ અરજી અને પ્રવેશ પ્રક્રિયાની સમજ સાથે હસ્તક્ષેપ કરતા નથી. મૌખિક દુભાષિયાઓ કે ભાષાંતર કરેલું સાહિત્ય માર્કેટ પ્લેસ કોલ સેન્ટર મારફતે મફતમાં ઉપલબ્ધ હોય છે અને માહિતી સંપૂર્ણપણે પહોંચ યોગ્ય અને સમજી શકાય તેવી બનાવવાના હેતુસર જરૂરી હોઈ શકે. સહાયકોએ આ સેવાઓ સુધી પહોંચવું જોઈએ અને સેવાઓ અરજીકર્તાઓ કે તેઓના કુટુંબીજનોને પૂરી પાડવી જોઈએ જો તેની જરૂર પડે. આ સેવાઓ મફત ઉપલબ્ધ હોવાને લીધે, અરજીકર્તા કે તેઓના કુટુંબીજન માટે કોઈ કિંમત હોવી જોઈએ નહીં.
- જો ગ્રાહકો અંગ્રેજી સિવાયની ભાષાઓ બોલતા હોય અને બીજી કોઈ ભાષામાં અંગત સહાયતા મેળવવા ઇચ્છે, તો તેઓ માર્કેટ પ્લેસને આ નંબર પર ફોન કરી શકે છે, 1-800-318-2596. ગ્રાહકોને સમજાવો કે માર્કેટ પ્લેસ અન્ય ભાષાઓમાં સહાયતા મફતમાં પૂરી પાડે છે. તમે વેબસાઇટ [HealthCare.gov](https://www.healthcare.gov) પર અંગ્રેજી સિવાયની ભાષાઓમાં મદદ કરતી રૂબરૂમાં સહાયક સંસ્થાઓ શોધવા “સ્થાનિક મદદ શોધો” જોઈ શકો છો:  
<https://localhelp.healthcare.gov/>.

## પાત્રતા અને પ્રવેશ પડકારોને પહોંચી વળવાની ખાનગી માહિતી

વિદેશી વસવાટી ગ્રાહકોને મદદ કરો ત્યારે, સહાયકોને નીચેના સંભવિત પડકારોની જાણ હોવી જોઈએ:

- વિદેશી વસવાટી ગ્રાહકો માટે સામાન્ય હોય તેવા આવકના જુદા જુદા સ્ત્રોતોથી સહાયકો માહિતગાર હોવા જોઈએ, જેમાં કોઈ સ્થિર આવક, વિદેશી આવક કે સ્વરોજગારના ધંધાની આવક ન ધરાવતા ઋતુલક્ષી કામદારો સામેલ છે. આ જુદા જુદા પ્રકારની આવક વીમો પરવડી શકે તેવા ઓછા ખર્ચાળ આરોગ્ય વીમા કવચના કાર્યક્રમો માટેની પાત્રતાને અસર કરી શકે છે.
- ગ્રાહકોએ એપોઇન્ટમેન્ટમાં તેઓની સાથે કયા દસ્તાવેજો લાવવા જોઈએ તેઓ તે ઓળખી કાઢે તે માટે સહાયકોએ તેઓને મદદ કરવી જોઈએ અને સ્વીકાર્ય દસ્તાવેજીકરણના ઉદાહરણો આપવા જોઈએ (દા.ત. SSN કાર્ડ, કાયમી રહેવાસી કાર્ડ કે “ગ્રીન કાર્ડ,” રોજગાર અધિકૃતિ કાર્ડ કે શરણાર્થી કાર્ડ). આ ગ્રાહકો એપોઇન્ટમેન્ટ લેવા ફોન કરે ત્યારે કરી શકાય છે પણ પ્રવેશ મેળવવા કયા દસ્તાવેજીકરણની જરૂર છે તે સમજાવતા ફ્લાયર, બ્રોશર કે અન્ય હેન્ડઆઉટ્સ જેવી માહિતી પત્રિકાઓ વડે પ્રસંગોપાત પણ કરી શકાય છે. સ્વીકાર્ય દસ્તાવેજોની યાદી માટે, વેબસાઇટ જુઓ: <https://www.healthcare.gov/immigrants/documentation/>\*\*\*.
- સહાયકોએ ખાતરી કરવી જોઈએ કે ગ્રાહકો જાણતા હોય કે નાગરિકતા અને ઇમિગ્રેશન સ્થિતિના દસ્તાવેજીકરણની જરૂર માત્ર વીમા કવચ માટે અરજી કરનારાઓ માટે પડે છે અને કુટુંબના અન્ય સભ્યો માટે નહીં.
- ગ્રાહકો ઓનલાઇન અરજી કરવા માગેલી તમામ ઇમિગ્રેશન માહિતી સમાવે તે માટે સહાયકોએ તેઓને પ્રોત્સાહિત કરવા જોઈએ જો દસ્તાવેજનો પ્રકાર અને સંખ્યા જાણમાં અને ઉપલબ્ધ હોય. આનાથી એ સંભાવના વધી જશે કે ગ્રાહકોની ઇમિગ્રેશન અને નાગરિકતા સ્થિતિને સફળતાપૂર્વક ચકાસવામાં આવે.



- સહાયકોએ જાણવું જોઈએ કે ગ્રાહકો ન પણ જાણતા હોય કે ઓનલાઇન પ્રવેશ મેળવવા તેઓનું ઇમેલ ખાતું હોવું જરૂરી છે. ઇમેલ ખાતાઓ બનાવવા ગ્રાહકો સાથે કામ કરવા માટે વધારાનો સમય ફાળવવાની જરૂર પડી શકે. ગ્રાહકો માર્કેટ પ્લેસને 1-800-318-2596 નંબર પર ફોન કરીને ફોન પર પણ પ્રવેશ મેળવી શકે છે.
- સહાયકોએ એવું ફોર્મ વિકસાવવાનું પણ વિચારવું જોઈએ જેમાં ગ્રાહકો નીચેની માહિતી ભરી શકે છે:
  - વેબસાઇટ HealthCare.gov પર તેઓની ખાતાકીય માહિતી;
  - તેઓનો પાસવર્ડ શું છે તે યાદ અપાવતો ઇશારો;
  - તેઓના પ્રિમિયમોની રકમ, કપાતપાત્ર અને સહિયારો વીમો સહિત તેઓની આરોગ્ય વીમા વિશેની વિગતો; અને
  - બીજી કોઈ માહિતી જે ગ્રાહકોને પોતાના આરોગ્ય સંભાળ કવચને લગતી મહત્વની માહિતી હાથવગી રાખવામાં મદદ કરે.

એક કાગળ પર સહાયકનું નામ અને સંપર્ક માહિતી જેવી માહિતી પૂરી પાડવાથી ગ્રાહકોને તેઓના સહાયકનો સંપર્ક કરવામાં મદદ મળી શકે છે જો તેઓને કોઈ પ્રશ્નો હોય. આ માહિતીને ગ્રાહકો પોતાના પાકીટમાં રાખી શકે તેવા કોઈ સૂચક કે ધંધાકીય કાર્ડ પર પણ ટૂંકાણમાં રાખી શકે છે.

- વિદેશી વસવાટીઓને અરજીનો ઓળખ પુરાવો સંતોષતી સમસ્યાઓ હોઈ શકે કારણ કે તેઓ પાસે ઓળખ પુરાવા માટે જરૂરી ક્રેડિટ (શાખ) ઇતિહાસ હોય તેવી ઓછી શક્યતાઓ રહેતી હોય છે. સહાયકો ગ્રાહકોને ઓળખ પુરાવાની પ્રક્રિયામાં સહાયતા કરવા તૈયાર હોવા જોઈએ, જેમાં તેઓને હોઈ શકતા કોઈ પડકારોનો સમાવેશ થાય છે. ઓળખ પુરાવો પૂરો કરવા, ગ્રાહકોએ વિવિધ વિષયો પર પ્રશ્નોના જવાબ આપવાની જરૂર પડશે, જેમ કે:
  - તેઓ હાલમાં અને ભૂતકાળમાં રહ્યા હોય તેવા સરનામાઓ;
  - હાલના અને ભૂતકાળના નિયોક્તાઓના નામો; અને
  - તેઓના મોર્ગેજ (ગીરો), ક્રેડિટ કાર્ડો અને/અથવા લોન વિશેની માહિતી.

સંભવિત પ્રશ્ન વર્ગીકરણોની પૂરી યાદી શોધી કાઢો: <https://marketplace.cms.gov/outreach-and-education/your-marketplace-application.pdf>\*\*\*.

એક્સ્પિરિયન અને ઇક્વિફેક્સ જેવી ક્રેડિટ રિપોર્ટિંગ એજન્સીઓનો ઉપયોગ CMS ગ્રાહકોની અરજીમાંની માહિતીને ચકાસવા માટે કરે છે, જેથી તેઓના ક્રેડિટ સ્ત્રોતો તપાસતી વખતે તેઓ પાસે CMS ની પૂછપરછ આવી શકે. આ CMS પૂછપરછ ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પર અસર કરતી નથી.

- ગ્રાહકોના ડેટા મળતા આવવા સંબંધિત મુદ્દાઓ માટે સહાયકો તેઓને મદદ કરવા તૈયાર રહેવા જોઈએ. સહાયકોએ ગ્રાહકોને પોતાની પાત્રતા નોટિસો કાળજીપૂર્વક વાંચવા તેમજ તેઓને મળતી કોઈ રિમાઇન્ડર નોટિસો વાંચવા પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી ખાતરી કરી શકાય કે તેઓ પ્રવેશ સમૂહના સાચા સભ્ય માટે સાચી માહિતી રજૂ કરે છે. ગ્રાહકો પોતાનું માર્કેટ પ્લેસ ખાતું તપાસીને એ નિર્ધારિત પણ કરી શકે છે કે શું તેઓના કોઈ ન ઉકેલેલા ડેટા મળતા આવવાના વિવાદો છે કે નથી, જ્યાં “અરજીઓની વિગતો” હેઠળ તમામ ન ઉકેલેલી અસંગતતાઓની યાદી હશે. માર્કેટ પ્લેસને રજૂ કરેલા દસ્તાવેજોની સ્થિતિ વિશે પ્રશ્નો ધરાવતા ગ્રાહકોએ માર્કેટ પ્લેસ કોલ સેન્ટરને ફોન કરવો જોઈએ.
- સહાયકો જાણતા હોવા જોઈએ કે ડેટા મળતા આવતા હોય તેવા મુદ્દાઓ માટે વિવાદ ઉકેલાય તે પહેલાં વીમા કવચ માટે ગ્રાહકો હજુ પણ અરજી કરી શકે છે. જો ગ્રાહકોના ઇમિગ્રેશન કે નાગરિકતાના ડેટા મળતા હોવાના મુદ્દાઓ ઉકેલાયા વગરના રહે, તો તેઓ માર્કેટ પ્લેસ મારફતે વીમા કવચ માટે પાત્રતા ગુમાવી શકે. જો

ગ્રાહકોના આવક ડેટા મળતા હોવાના મુદ્દાઓ ઉકેલાયા વગરના રહે, તો તેઓની પ્રિમિયમ ટેક્સ ક્રેડિટો અને ખર્ચ-વહેંચણી કપાતોનો અનુભવ તેઓને થઈ શકે.

## વિદેશી વસવાટી ગ્રાહક પાત્રતાનો કાલ્પનિક ઘટનાક્રમ

ઇવા અને એડન સેન્ટોસ, બંનેની ઉંમર 28 વર્ષ, તેઓ પરણિત છે અને તાજેતરમાં તેઓને બાળકી સેરેના જન્મી છે, જેનો જન્મ યુએસમાં થયો હતો. એડન આ વર્ષે નાગરિક બન્યો. ઇવા કાયદેસર રીતે કાયમી રહેવાસી બનવા અરજી કરી રહી છે અને એડને તેણી વતી વિઝા અરજી રજૂ કરી જેને સાપ્ટેમ્બરમાં મંજૂરી મળી હતી. તેઓની વાર્ષિક કૌટુંબિક આવક \$24,000 કે FPL નાં 121% છે. એડન અને ઇવા સાથે મળીને કરો ભરે છે અને સેરેનાનો આશ્રિત તરીકે દાવો કરે છે. ઇવા પોતાના આખા કુટુંબને આરોગ્ય વીમા કવચ મેળવવામાં મદદરૂપ થવા એક સહાયકનો સંપર્ક કરે છે પણ તેણી ચોક્કસ નથી કે શું તેઓ સૌ તેને પાત્ર છે. સેન્ટોસ કુટુંબમાટે પાત્રતા નિર્ધારણો શું રહેશે? શું એડન, ઇવા અને સેરેના સરખા પ્રકારના વીમા કવચમાં પ્રવેશવા સક્ષમ રહેશે?

**જવાબ:** એડન, ઇવા અને સેરેના તેઓની જુદી જુદી નાગરિકતા સ્થિતિને લીધે એકસરખા પ્રકારના વીમા કવચમાં પ્રવેશવા સક્ષમ ન પણ રહે. તેઓની પ્રવેશ માટેની પાત્રતા જો તેઓ એવા રાજ્યમાં રહેતા હોય જ્યાં મેડિકએઇડ વીમા કવચ વિસ્તારેલું છે કે કેમ તેની પર પણ આધાર રાખી શકે છે. સેન્ટોસ માટેના પાત્રતા નિર્ધારણો નીચે જણાવ્યા મુજબ રહેશે:

- **એડન:** એક યુએસ નાગરિક તરીકે, એડન માર્કેટ પ્લેસ મારફ્ટે QHP માં પ્રવેશ મેળવવા પાત્ર બને તેવી શક્યતા રહેલી છે અને તે મેડિકએઇડ માટે પાત્ર બની શકે. જો તેમના રાજ્યએ મેડિકએઇડ FPL નાં 138% સુધી વિસ્તાર્યું હોય, તો એડનની આવક તેને મેડિકએઇડ વીમા કવચ માટે લાયક બનાવે છે. નોંધી લેશો કે મેડિકએઇડ વિસ્તરણ રાજ્યમાં, એડન માર્કેટ પ્લેસ મારફ્ટે APTC કે CSRs માટે પાત્ર બનશે નહીં. જો એડન મેડિકએઇડ ન વિસ્તારવાનું હોય તેવા રાજ્યમાં રહેતો હોય અને માર્કેટ પ્લેસ મારફ્ટે વીમા કવચ મેળવે, તો એડન માર્કેટ પ્લેસ મારફ્ટે APTC અને CSRs માટે પાત્ર બને તેવી શક્યતા રહે છે.
- **ઇવા:** ઇવા કાયદેસર રીતે હાજર હોવાનું ગણવામાં આવે છે અને તેથી માર્કેટ પ્લેસ વીમા કવચ મેળવવાના પાત્ર બની શકે. ઇવાને મેડિકએઇડ પાત્રતાના હેતુસર “લાયક નાગરિક સિવાયની વ્યક્તિ” હજુ સુધી માનવામાં આવતી નથી. જો ઇવા માર્કેટ પ્લેસ મારફ્ટે વીમા કવચ મેળવે, તો તેણી માર્કેટ પ્લેસ મારફ્ટે APTC અને CSRs મેળવવાને પાત્ર બની શકે.
- **સેરેના:** સેરેનાનો જન્મ યુએસમાં થયો હોવાને લીધે, તેણી નાગરિક છે અને મેડિકએઇડ વીમા કવચ મેળવવાને પાત્ર છે, જો તેણી રાજ્યમાં અન્યથા પાત્રતા માપદંડ સંતોષે.

## વધારાના સંસાધનો

વધુ માહિતી માટે વેબસાઇટ જુઓ:

**HealthCare.gov:** ઇમિગ્રાન્ટ્સે (વિદેશી વસવાટીઓએ) જાણવી જરૂરી માહિતી<sup>1</sup>

**Marketplace.CMS.gov:** ઇમિગ્રાન્ટ્સ (વિદેશી વસવાટીઓ) માટેની માહિતી<sup>2\*\*\*</sup>

**Marketplace.CMS.gov:** માર્કેટ પ્લેસ અરજી પર નાગરિકતા અને ઇમિગ્રેશન સંબંધિત પ્રશ્નો<sup>3</sup>

1 <https://www.healthcare.gov/what-do-immigrant-families-need-to-know/>\*\*\*

2 <https://marketplace.cms.gov/technical-assistance-resources/special-populations-help.html>\*\*\*

3 <https://marketplace.cms.gov/technical-assistance-resources/citizenship-questions-on-marketplace-application.pdf>\*\*\*

\*\*\*આ ઉત્પાદનની વિદેશી આવૃત્તિ આ સમયે ઉપલબ્ધ નથી.